

ગુજરાત સરકાર



અનુસૂચિત જાતિ કલ્યાણ

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહિત્ય પ્રકાશન યોજના હેઠળ અનુ.જાતિના લેખકો, સાહિત્યકારો અને પી.એચ.ડી. ધારકોને તેમના સાહિત્યના પ્રકાશન માટે નાણાંકીય સહાય મેળવવા માટેનું અરજી પત્રક

અરજદારનો  
પાસપોર્ટ  
સાઈઝનો  
તાજેતરનો રંગીન  
ફોટો

- (૧) અરજદારનું નામ (અટક પહેલાં લખવી) :-
- (૨) અરજદારનું પુરેપુરું સરનામું :-  
(ફોન નં. મો. નંબર અવશ્ય લખવો.) :-
- (૩) અરજદારનું કાયમી સરનામું. :-
- (૪) અરજદારની જાતિ :-  
(સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ અનુ.જાતિના જાતિ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જોડવી.)
- (૫) સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ કેટલા સમયથી કરો છો.
- (૬) (અ) આ યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષમાં સહાય :-  
મેળવવા અરજી કરેલ હોય તો તેની વિગત

ક્રમ	વર્ષ	કૃતિનું નામ
૧		
૨		
૩		

(બ) સહાય મળેલ હોય તો તેની વિગત

ક્રમ	વર્ષ	કૃતિનું નામ	સહાયની રકમ રૂ.
૧			
૨			
૩			

(૭) કેવા કેવા પ્રકારનું સાહિત્ય પ્રસિધ્ધ કરવા માંગો છો ?  
તેની ટુંકી વિગતો

નોંધ :- આપ જે કૃતિ / પુસ્તક પ્રકાશિત કરવા માંગતા હોય તેની  
હસ્તપ્રત અરજી સાથે અચુક મોકલવાની રહેશે.

- (૮) કયા પ્રકાશન ધ્વારા પ્રસિધ્ધ કરવાના છો ? :-
- (૯) પ્રકાશન પાછળ અંદાજે કેટલો ખર્ચ થનાર છે. :-
- (૧૦) કૃતિ / પ્રકાશન કેટલા સમય સુધીમાં પ્રસિધ્ધ થશે. :-
- (૧૧) અરજદારનો બેંક એકાઉન્ટ નંબર :-
- (૧૨) બેંકનું નામ :-
- (૧૩) શાખાનું નામ :-
- (૧૪) બેંકનો IFSC CODE નંબર :-
- (૧૫) અરજદારનો આધારકાર્ડ નંબર :-
- (૧૬) અરજદારનો પાનકાર્ડ નંબર :-

અરજી સાથે નીચે મુજબના દાખલા / આધારની સ્વપ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે.

- (૧) જાતિ અંગેના પ્રમાણપત્રની નકલ
- (૨) રેશનકાર્ડની નકલ
- (૩) ઉંમરનો પુરાવો
- (૪) શૈક્ષણિક લાયકાતના આધારો
- (૫) બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
- (૬) આધાર કાર્ડની નકલ
- (૭) પાનકાર્ડની નકલ
- (૮) કૃતિની હસ્તપ્રતની નકલ

સ્થળ :-

તારીખ :-

અરજદારની સહી/-

મહારાજા સયાજીરાવ સાહિત્ય પ્રકાશન સહાય યોજના અન્વયે અનુસૂચિત જાતિના લેખકો, સાહિત્યકારો અને પી. એચ. ડી. ધારકોને તેમના સાહિત્યના પ્રકાશન માટે નાણાંકીય સહાય આપવા અંગેના નિયમો

સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ: ૧૯/૧૨/૨૦૦૧ના ઠરાવ ક્રમાંક: એસસીડબલ્યુ-૧૦૦૧-ન.બા.૧૪.ગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવથી અનુસૂચિત જાતિના સાહિત્યકારો સર્જકો, સંશોધકો અને પી.એચ.ડી. ધારકોને તેમના લખાણો પ્રસિદ્ધ કરવા માટે રૂ. ૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દશ હજાર પુરા) સુધીની સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંગેની સામાન્ય શરતો નીચે મુજબ છે.

- ૧ અનુસૂચિત જાતિના વર્ગની વિવિધ સમસ્યાઓ સંબંધિત લખાણો અને સાહિત્યના પ્રકાશન માટે જ સહાય મેળવવાપાત્ર રહેશે.
- ૨ આ સહાય કેવળ મૌલિક લખાણો માટે જ મળી શકશે. અન્ય કોઈપણ અનુદાન માટે સહાય મળી શકશે નહીં.
- ૩ શરતો:-
  - (ક) સહાય માટે પાત્ર ઠરેલી હસ્તપ્રત માટે વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦ (અંકે રૂપિયા દશ હજાર પુરા)ની મર્યાદામાં હસ્તપ્રતની ૫૦૦ નકલોના મુદ્રણ અંગે કરેલા ખરેખર ખર્ચના ૭૫ ટકા સહાય આપવામાં આવશે. પરંતુ કોઈપણ કિસ્સામાં સહાયની રકમ રૂ. ૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દશ હજાર પુરા)થી વધશે નહીં મંજૂર કરાયેલ સહાયની કૃતિ પ્રકાશિત કરી તેના મુદ્રણ અંગેના વાઉચર નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને રજૂ કર્યેથી સહાયની રકમ ચુકવવાપાત્ર થશે.
  - (ખ) પ્રગટ કરેલી નકલોની સંખ્યા ૫૦૦ કરતાં ઓછી હોવી જોઈશે નહીં.
  - (ગ) પ્રગટ કૃતિની ૧૫ નકલો વિનામૂલ્યે નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાની રહેશે.
  - (ઘ) “સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારની નાણાંકીય સહાયથી પ્રકાશિત કર્યું.” એવી ઋણ સ્વીકારની પંક્તિ અંદરના મુખ્યપૃષ્ઠની પાછળ સ્પષ્ટ રીતે છપાવવાની રહેશે.
  - (ચ) પ્રગટ થતી કૃતિમાં કોઈ જાહેરાત કે કોઈ પ્રકારનો વેપાર વિષયક સંદેશો લઈ શકાશે નહીં તેમજ કોઈ વિવાદ ઉભો થાય કે સુરૂચિનો ભંગ થાય તેવું કે સરકારે પ્રતિબંધિત કર્યા હોય તેવા શબ્દો પ્રયોજીત કરી શકાશે નહીં.
  - (છ) આ યોજના હેઠળ સહાય મંજૂર કરવામાં આવી હોય તેવી હસ્તપ્રતમાં નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની પૂર્વ મંજૂરી સિવાય કોઈ સુધારો કરી શકાશે નહીં.
  - (જ) હસ્તપ્રત મંજૂરીના હુકમની તારીખથી એક વર્ષમાં પ્રગટ કરવાની રહેશે.

સમયમર્યાદામાં પ્રગટ નહીં કરનારની સહાય આપોઆપ રદ થયેલી ગણાશે. નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને પોતાને એમ કરવું જરૂરી જણાય તો સહાય મંજૂર કરતા હુકમ હેઠળ ઉપર જણાવેલી શરતો ઉપરાંત બીજી શરતોનું પાલન કરવાનું આવશ્યક બનાવી શકાશે.

- (ઝ) હસ્તપ્રતની જોડણી સરકાર માન્ય ગુજરાત વિધાપીઠની સાર્થ જોડણી કોશ પ્રમાણે રાખવાની રહેશે.
- (ટ) મળેલ સહાયની રકમ અન્ય કોઈ ખાનગી પ્રકાશન કે સંસ્થાને તબદિલ કરી શકાશે નહીં તથા તે માટેની આર્થિક સહાય અન્યત્રથી મેળવી શકાશે નહીં.
- (ઠ) પુસ્તકના પ્રકાશન બાદ તેમાંના લખાણ સંબંધે કોઈપણ વિવાસ કે કાનૂની પ્રશ્નો ઉભા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લેખકની રહેશે.
- (ડ) આ યોજના હેઠળ આ અગાઉ અનુસૂચિત જાતિના જે લેખકો, સાહિત્યકારો, સંશોધકો, સર્જકો અને પી.એચ.ડી ધારકોને લાભ મળેલ છે. તેઓને બીજીવાર આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. જેથી અગાઉ આ યોજના હેઠળ સહાય મળેલ હોય તેવા અનુસૂચિત જાતિના સાહિત્યકારોએ બીજીવાર અરજી કરવી નહીં.

## એકરાર નામુ

આથી હું શ્રી .....

મુ.

.....

તા ..... જિલ્લો ..... ઉ. વર્ષ .....

તે આથી લેખિત બાંહેધરી આપું છું કે સરકારશ્રીના તારીખ: ૨૨ / ૦૫ / ૨૦૦૨ના ઠરાવ ક્રમાંક - એસસીડબલ્યુ / ૧૦૦૧ / ન.બા.૧૪ / ગ, થી અમલમાં મુકવામાં આવેલ અનુસૂચિત જાતિના લેખકો, સાહિત્યકારો અને પી.એચ.ડી ધારકોને તેમના સાહિત્યના પ્રકાશન માટે રૂા. ૧૦,૦૦૦/- સુધીની સહાય આપવાની “ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહિત્ય પ્રકાશન યોજના” અન્વયે નિયત કરવામાં આવેલ તમામ શરતો મેં કાળજી પૂર્વક વાંચેલ છે. અને તે મને કબુલ મંજુર છે. તથા તમામ શરતો પરિપૂર્ણ કરવાની આથી હું ખાત્રી આપું છું. તથા અમોને આ યોજના હેઠળ સહાયની કોઈ રકમ આજદિન સુધી મળેલ નથી. તેની પણ ખાત્રી આપવામાં આવે છે.

સ્થળ:-

તારીખ:-

અરજદારની સહી/-